

કાર્યપ્રણાલીનું નામ  
કાર્યપ્રણાલીનો રાજ્ઝીય આઈડી (ID)

GENVASC અલ્યાસ  
જનીન વિષયક અને વાસ્ક્યુલર આરોગ્ય તપાસ કાર્યક્રમ

સહભાગીઓ માટે સંમતિ પત્રક આવૃત્તિ 4.1 (14મી જાન્યુઆરી  
2013)

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર હૈલ્થ રીસર્ચ  
(National Institute for Health Research)

શિર્ષક, પ્રથમ, અને અટક  
સરનામું

જન્મ તારીખ  
એનેચેચેસ (NHS) નંબર

તમે સહમત હોવ તે વિધાનને દર્શાવવા કૃપા કરીને આધ્યાક્ષર કરો

1	મેં 7મી ડિસેમ્બર 2012 તારીખનું સંક્ષિપ્ત કરેલ સહભાગી માહિતી પત્રક આવૃત્તિ 2.0 ને વાંચી છે અને સમજ્યો/સમજું છું તથા <u>21મી ઓગસ્ટ 2012</u> તારીખની સહભાગી માહિતી <u>પત્રિકા આવૃત્તિ 3.0</u> આપવામાં આવી છે.	
2	હું લોહીના નમૂનાનો દાન આપવા સહમત છું, અને કાર્ડિયોવાસ્ક્યુલર સંશોધનમાં (ડિએનએ (DNA) સંશોધન સહિત) તેનો ઉપયોગ કરવા મંજૂરી આપું છું. હું સમજું છું કે મારું દાન સ્વૈચ્છિક છે અને તે માટે નમૂનાઓ અંગે કોઈપણ વ્યક્તિગત પ્રતિભાવ મને મળશે નહિં.	
3	હું ભવિષ્યમાં કાર્ડિયોવાસ્ક્યુલર સંશોધન માટે મારા લોહીના નમૂનાઓનો સંગ્રહ કરવા માટે સહમતિ આપું છું.	
4	હું મારા તબીબી રેકૉર્ડ્સ પરની માહિતીનો સંગ્રહ કરાય અને સંશોધન માટે તેનો ઉપયોગ કરાય તે માટે સહમત છું. હું સમજું છું કે મારી ઓળખ સુરક્ષિત રખાશે અને મારી તબીબી સંભાળ આનંગી રહેશે.	
5	સંશોધન પ્રાયોજક અને યુકે સત્તાપિકારીઓ સંશોધનને હાથ ધરવાના ઓડિટ માટે મારા રેકૉર્ડ્સને એક્સેસ કરી શકશે તેને હું સમજું છું.	
6	હું સહમત થવું છું કે મારી તબીબી સ્થિતિની ભાવિ વિગતો મારા એનેચેચેસ નંબરનો ઉપયોગ કરીને ડેટાબેઝ શોધોમાંથી મેળવી શકશે.	

તમે સહમત હોવ તે વિધાનને દર્શાવવા કૃપા કરીને નીચે આધ્યાક્ષર કરો અથવા તમે અસહમત હોવ તે વિધાનને દર્શાવવા X કરો.

7	વૈકલ્પિક ભવિષ્યમાં જો કોઈ યોગ્ય સંશોધન પ્રોજેક્ટ્સ હોય જેમાં હું કદાચ ભાગ લેવાની ઇચ્છા ધરાવું તો સંશોધન ટીમ મારો સંપર્ક કરી શકે તે માટે હું સંમતિ આપું છું. વિનંતીના સમયે સહમત થવા મને કોઈ ફરજ પાડવામાં આવી નથી તે હું સમજું છું. મારું ઇમેઇલ સરનામું નીચે પ્રમાણે છે :	
---	---	--

### નીચેની ફિલ્ડ સને (સહી સિવાય) મોટા અક્ષરોમાં હાથથી લખવી જોઈશે

દર્દીનું નામ : \_\_\_\_\_ (નામ પ્રિન્ટ કરો)

સંમતિ લેનાર વ્યક્તિત્વ : \_\_\_\_\_ (નામ પ્રિન્ટ કરો)

હોસ્પિટ : \_\_\_\_\_ (દા.ન. સામાન્ય ચિકિત્સક (GP), પ્રેક્ટિસ નાસ)

સહી : \_\_\_\_\_

સહી : \_\_\_\_\_

તારીખ : \_\_\_\_\_ (dd/mm/yyyy)

તારીખ : \_\_\_\_\_ (dd/mm/yyyy)

પત્રક 1 : સ્થળ ફાઈલ, પત્રક 2 : નમૂનો, પત્રક 3 : સામાન્ય ચિકિત્સકની તબીબી નોંધો, પત્રક 4 : દર્દી

પ્રોજેક્ટ અંગેની પૂછપરછો નીચેના સરનામે કરી શકાય છે :

Leicester Cardiovascular Biomedical Research Unit.

Department of Cardiovascular Sciences, Clinical Science Wing.

Glenfield Hospital, Groby Road. Leicester. LE3 9QP. UK

ટેલિફોન નંબર: 0116 2583385 // ઇમેઇલ: genvasc@le.ac.uk

PISICF આવૃત્તિ 4.1, 14મી જાન્યુઆરી 2013